

B.Com. Semester - 5 (NEP-2020) Examination**Oct/Nov - 2025****Banking & Finance -5 (Minor-5)****Time: 2:00 Hours****Marks: 50****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	બેંક ધિરાણ સામે લેવામાં આવતી જામીનગીરીઓના વિવિધ પ્રકારોની ચર્ચા કરો.	(૧૦)
	અથવા	
પ્રશ્ન.૧	બેંકિંગ ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવતી આધુનિક ટેકનોલોજી ની ચર્ચા કરો.	
પ્રશ્ન.૨	બેંક ઓફ ઇંગ્લેન્ડના કાર્યોની ચર્ચા કરો.	(૧૦)
	અથવા	
પ્રશ્ન.૨	બેંક ઓફ ઇંગ્લેન્ડના ઉદ્ભવ અને તેના સંચાલનની સમજૂતી આપો.	
પ્રશ્ન.૩	સૂક્ષ્મ ધિરાણ એટલે શું? તેના હેતુઓની ચર્ચા કરો.	(૧૦)
	અથવા	
પ્રશ્ન.૩	સૂક્ષ્મ ધિરાણના લાભ અને ગેરલાભની ચર્ચા કરો.	
પ્રશ્ન.૪	ભારતમાં સહકારી પ્રાદેશિક ગ્રામીણ બેંકના ઉદ્ભવની ચર્ચા કરી તેનું મહત્વ સમજાવો.	(૧૦)
	અથવા	
પ્રશ્ન.૪	ભારતમાં સહકારી પ્રાદેશિક ગ્રામીણ બેંકના ફાયદાઓ અને મર્યાદાઓની સમજૂતી આપો.	
પ્રશ્ન.૫	ટૂંકનોંધ લખો: (કોઈપણ બે)	(૧૦)
	(1) CTS -2010.	
	(2) બેંક ઓફ ઇંગ્લેન્ડની શાખા નીતિ.	
	(3) સૂક્ષ્મ ધિરાણનું મહત્વ.	
	(4) સહકારી પ્રાદેશિક ગ્રામીણ બેંકના વિવિધ ઘટકો.	

ENGLISH VERSION

Que.1	Discuss the different types of securities taken against bank loans.	(10)
	OR	
Que.1	Discuss the modern technology used in the banking sector.	
Que.2	Discuss the functions of the Bank of England.	(10)
	OR	
Que.2	Explain the origin and management of the Bank of England.	
Que.3	What is microfinance? Discuss its objectives.	(10)
	OR	
Que.3	Discuss the advantages and disadvantages of microfinance.	
Que.4	Discuss the origin of Co-operative Regional Rural Bank in India and explain its importance.	(10)
	OR	
Que.4	Explain the advantages and limitations of Cooperative Regional Rural Bank in India.	
Que.5	Write a short note on: (Any two)	(10)
	(1) CTS -2010.	
	(2) Credit policy of Bank of England.	
	(3) Importance of microfinance.	
	(4) Various components of Cooperative Regional Rural Bank.	
